

Date: 21st August, 2020

The Manager,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers
'A' wing,
Dalal Street, Fort,
Mumbai - 400021

**Subject: Annoucement under Regulation 30 of SEBI(LODR) regulation 2015-
Newspaper clippings- Notice to the shareholders of 28th Annual General Meeting
along with Remote E-voting Information and Book Closure**

Reference: Scrip Code -541503; ISIN - INE250G01010; SYMBOL: UNICK

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copy of newspaper clippings of Notice of the shareholders of 28th Annual General Meeting along Remote E-voting information and Book Closure published in Western Times (Gujarati) Ahmedabad Morning Edition, Western Times (English) Ahmedabad Morning Edition newspaper on Thursday 20th August, 2020.

This is for your information and record.

Thanking you,

Yours faithfully

For Unick Fix-a-form & Printers Limited

Asthg

Astha Pandey
Company Secretary



Enc: As above

Hinduja Foundation donates Rs 1 Crore for COVID critical care in Mumbai

Mumbai, Hinduja Foundation, the philanthropic arm of the 100-year-old Hinduja Group, has provided Rs 1 Crore worth of support to set up a COVID-19 care facility in Khar, Mumbai at the behest of the Brihanmumbai Municipal Corporation (BMC). This facility, named 'Deepvan', will provide emergency healthcare services to COVID-19 patients. Two months after Bollywood superstar Shahrukh Khan offered the use of his office premises in Khar for COVID relief, BMC requested Hinduja HealthCare, Khar for their technical support in converting the area into an intensive care unit for critical COVID-19 patients. The Foundation stepped in with a donation amounting to Rs 1 Crore, in the form of capital expenditure for medical equipment, PPE kits and other support to get the facility opera-

tional for the BMC. More than 60 patients availed of free treatment in the past month, as part of the Foundation's continuing social commitment to COVID relief. Following an additional request from the BMC, 'Deepvan' is now operational with enhanced healthcare services as well as four ICU beds, four centralised oxygen beds and seven DCHC (Dedicated COVID Health Centre) ward beds. Commenting on the initiative, Mr Paul Abraham, President, Hinduja Foundation said, "We have committed to fund this initiative to the tune of Rs 1 Crore so far. We are proud to associate with Hinduja Hospital, Khar and provide 'Deepvan' with the required infrastructure to treat COVID-19 patients. We recognize the responsibility of the private sector in identifying and boosting healthcare facilities for the common man in these uncertain times."

"We thank Hinduja Foundation for their support in setting-up COVID-19 care facilities," said Dr Avinash Supe, Executive Director of Hinduja HealthCare, Khar. "As the BMC is in dire need of care centres owing to the rapid increase in the number of COVID-positive patients, we are happy to extend our support to them."

Despite Covid sugar offtake to remain unaffected

New Delhi, Despite the Covid-19 pandemic, sugar offtake in the current sugar season is expected to remain more or less at last season's levels, Crisil Research said on Wednesday. The sugar season runs from October-September. According to Crisil Research, buoyant exports are expected to make up for a visible shortfall in domestic consumption. "Industrial demand for sugar, which accounts for 60 per cent of total domestic consumption, is expected to fall 8-9 per cent in SS 2020 due to hotels, restaurants and cafes remaining shut and people avoiding crowded places," Crisil Research said in a statement. "Household consumption, which accounts for the remaining 40 per cent or so, however, is expected to slip just 2-3 per cent. Prolonged confinement at home has seen a surge in appetite for biscuits and bakery products."

CHANGE OF NAME
I have changed my name from **SOLANKI TUSHARBHAI SHASHIKANT** to new name **SOLANKI TUSHAR SHASHIKANT**
Add.: a/1, Lawrance Avenue, Sion Nagar, Opp. Alience Church, Maninagar East, Ahmedabad-380008 1067A

CHANGE OF NAME
I have changed my name from **SOLANKI TUSHARKUMAR SHASHIKANT** to new name **SOLANKI TUSHAR SHASHIKANT**
Add.: a/1, Lawrance Avenue, Sion Nagar, Opp. Alience Church, Maninagar East, Ahmedabad-380008 1067

share, a whopping 143 per cent growth (QoQ). Samsung Tab A series did really well, with the Galaxy Tab A 10.1 LTE and Wi-Fi (2019) series contributing close to 25 per cent of its market share. "Given their portable and larger screen size and, more importantly, much more affordable pricing, tablets are democratising access to digital content for all family members," said Prabhu Ram, Head-Industry Intelligence Group (IIG), CMR.

Apple came third in Q2 with a 12 per cent market share, growing 36 per cent (QoQ). Apple iPad 7 Series contributed close to 7 per cent of the market share. "Apple launched a new iPad Pro 2020 version with keypad, which is suitable for e-learning and content creators. It would be interesting to see how the iPad Pro 2020 contributes to Apple's growth in the coming quarters," said the report. —IANS

India tablet market shipments grow 23% in Q2, Lenovo leads

New Delhi, The strong demand during the lockdowns as work and learning shifted to homes fuelled the shipment of tablets in India by 23 per cent in the June quarter, a new report said on Wednesday.

The shipment of tablets with Wi-Fi capabilities grew a whopping 98 per cent (QoQ), according to CMR's 'Tablet PC Market Report Review for Q2 2020'. Lenovo continued to lead the tablet market with a 48 per cent market share, growing 24 per cent (QoQ). Lenovo M10 series contributed up to 14 per cent of its market share.

"In addition to the consumer demand, the tablet market grew on the back of agility shown by vendors and channel partners to offer attractive discounts to capitalise on the demand," said Menka Kumari, Analyst-Industry Intelligence Group (IIG), CMR. Samsung garnered 29 per cent market

Reliance Retail acquires majority stake in Netmeds for Rs 620 cr

New Delhi, Reliance Industries Limited (RIL) on Tuesday announced that its subsidiary Reliance Retail Ventures Limited (RRVL) has acquired a majority equity stake in Vitalic Health Pvt Ltd and its subsidiaries (collectively known as Netmeds) for a cash consideration of approximately Rs 620 crore.

This investment represents around 60 per cent holding in the equity share capital of Vitalic and 100 per cent direct equity ownership of its subsidiaries, Tresara Health Private Limited, Netmeds MarketPlace Limited and Dadha Pharma Distribution Private Limited. Incorporated in 2015, Vitalic and its subsidiaries are in the business of pharmaceutical distribution, sales and business support services. Its subsidiary also runs an online pharmacy platform —

Netmeds — to connect customers to pharmacists and enable door step delivery of medicines, nutritional health and wellness products. Speaking on the latest strategic investment, Isha Ambani, Director, RRVL, said, "This investment is aligned with our commitment to provide digital access for everyone in India. The addition of Netmeds enhances Reliance Retail's ability to provide good quality and affordable health care products and services, and also broadens its digital commerce proposition to include most daily essential needs of the consumers. We are impressed by Netmeds' journey to build a nationwide digital franchise in such a short time and are confident of accelerating it with our investment and partnership." Pradeep Dadha, Founder and CEO,

Netmeds, said, "It is indeed a proud moment for Netmeds to join the Reliance family and work together to make quality healthcare affordable and accessible to every Indian. With the combined strength of the group's digital, retail and tech platforms, we will strive to create more value for everyone in the ecosystem, while providing a superior Omni Channel experience to the consumers." Netmeds is a fully-licensed e-pharma portal that offers authenticated prescription and over the counter (OTC) medicine along with other health products. Netmeds offers a pan-India solution for quick online purchase and fast delivery of prescription medications to over 20,000 pin codes. Netmeds is promoted by Dadha Pharma, a Chennai-based company.

Business Brief

US dollar skids ahead of Fed minutes

New York, The US dollar dipped noticeably in late trading on Tuesday as market participants cautiously awaited the meeting minutes from the Federal Reserve.

The dollar index, which measures the greenback against six major peers, slipped 0.63 per cent at 92.2782. In late New York trading, the euro was up to \$1.1936 from \$1.1864 in the previous session, and the British pound increased to \$1.3240 from \$1.3101 in the previous session. The Australian dollar rose to \$0.7243 from \$0.7207, Xinhua reported.

The US dollar bought 105.39 Japanese yen, lower than 106.03 Japanese yen of the previous session. The US dollar fell to 0.9028 Swiss franc from 0.9063 Swiss franc, and it decreased to 1.3158 Canadian dollars from 1.3196 Canadian dollars. The Fed is set to publish the minutes from its latest policy meeting on Wednesday. The dollar has weakened considerably since the US central bank's aggressive move to maintain market liquidity amid the coronavirus pandemic. Meanwhile, experts noted that uncertainty in US politics is likely to pressure the greenback. "The market would have to be prepared for further uncertainties and possible (negative) surprises in US politics even if the US stock market might react positively short-term," Antje Praefcke, analyst at Commerzbank, said in a note on Tuesday, adding "the downside risks for the dollar will continue to dominate one way or the other."

S&P 500 closes at record high, recouping coronavirus losses

New York, The S&P 500 closed at a new record high on Tuesday, fully wiping out its losses triggered by the coronavirus pandemic. The benchmark index increased 7.79 points, or 0.23 per cent, to end at 3,389.78, surpassing its previous record close on February 19. It hit an intraday all-time high of 3,395.06 earlier in the session, Xinhua reported. The Nasdaq Composite Index rose 81.12 points, or 0.73 per cent, to 11,210.84, also a record close. However, the Dow Jones Industrial Average fell 66.84 points, or 0.24 per cent, to 27,778.07.

Shares of some big US tech names rallied, contributing to market gains. Amazon shares soared more than 4 per cent, while Google-parent Alphabet and Netflix climbed 2.6 per cent and 2 per cent, respectively.

Shares of Dow components Home Depot and Walmart both slipped despite strong earnings results. Meanwhile, US-listed Chinese companies traded mostly higher, with eight of the top 10 stocks by weight in the S&P US Listed China 50 index ending the day on an upbeat note.

JIYA ECO-PRODUCTS LIMITED
Office : F-11, Ruturaj Complex, Crescent Road, Bhavnagar - 364001.

Extracts of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended on 30th June, 2020
(₹ in Lakhs)

Particular	Standalone			Consolidated		
	Quarter ended 30.06.2020	Quarter ended 31.03.2020	Year ended 31.03.2020	Quarter ended 30.06.2020	Quarter ended 31.03.2020	Year ended 31.03.2020
Total income from operations (net)	-2067.39	-6645.55	7667.61	-2147.49	-6671.30	8368.46
Net Profit/(Loss) (before Extraordinary activities after tax)	14.38	-1619.36	-129.38	13.29	-1941.94	-60.34
Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)	14.38	-1619.36	-129.38	13.29	-1941.94	-60.34
Equity Share Capital	3007.33	3007.33	3007.33	3007.33	3007.33	3007.33
Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each	0.05	-5.39	-0.43	0.04	-6.46	-0.21
Basic:						
Diluted:						
Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each	0.05	-5.39	-0.43	0.04	-6.46	-0.21
Basic:						
Diluted:						

Note:
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results Standalone and Consolidated filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Audited Quarterly Financial results are available on the Stock Exchange websites.
(URL: https://www.bseindia.com/corporates/annndet_new.aspx?newsid=ebafec24-95d5-4460-8633-ec99ba35c904)

For and on behalf of Board of Directors
Jiya Eco-Products Limited
Sd/-
Bhaveshbhai Kakadia
Chairman and Managing Director

Place : Ahmedabad
Date : 19-08-2020

WESTERN TIMES
Disclaimer
Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

CHANGE OF NAME
old name **NIRESH KUMAR** to new name **THAKOR NILESHKUMAR SHANABHAI**
At-Post: Jodhpur Teh-Virpur, Dist. Mahisagar, Pin-388265, State- Gujarat Affidavit on-19 Aug-20 Advocate: L.N. Solanki Civil Court Virpur V024

CHANGE OF NAME
old name **RAHUL KUMAR** to new name **PARMAR RAHULKUMAR SHANABHAI**
At-Post: Jodhpur Teh-Virpur, Dist. Mahisagar, Pin-388265, State- Gujarat Affidavit on-19 Aug-20 Advocate: L.N. Solanki Civil Court Virpur V024A

UNICK FIX-A-FORM & PRINTERS LTD.

CIN : L25200GJ1993PLCO19158
PH NO. +91 9978931303/04/05, E-mail: info@unickfix-a-form.com
Regd. Office: Block No.472, Tajpur Road, Changodar, Tal: Sanand, Ahmedabad-382213

Notice of 28th Annual General Meeting, Remote E-voting and Book Closure

Notice is hereby given that the 28th Annual General Meeting of the members of **Unick Fix-A-Form And Printers Limited** CIN: L25200GJ1993PLCO19158 will be held on Wednesday, 30th September, 2020 at 04:00 p.m. through Video Conferencing or Other Audio Visual Means (OAVM) for which purpose the registered office at **Block No.472, Tajpur Road, Ahmedabad - Rajkot Highway, Changodar, Ahmedabad, Gujarat 382213** to transact the business as mentioned in the notice convening the said AGM. In view of the massive outbreak of the COVID-19 pandemic, social distancing is a norm to be followed and pursuant to the Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No.17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA) followed by Circular No. 20/2020 dated 5th May, 2020, physical attendance of the Members to the AGM venue is not required and Annual General Meeting (AGM) be held through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM). Hence, Members can attend and participate in the ensuing AGM through VC/OAVM only and no physical presence at the meeting is required. The Notice of AGM, Annual report have been sent in electronic mode to the members whose E-mail ID's are registered with depository to members along with the Explanatory Statement and the Annual Report at their E-mail IDs respectively. A copy of the Annual Report 2019-20 is also available on the website of the Company (www.unickfix-a-form.com), and BSE website, through VC/OAVM the Process is download Bluejeans application (<https://bluejeans.com>) in Laptops / mobile/iPads then selects on join meeting and put this ID and Passcode Meeting ID: 574 603 7600 Airtel Moderator Passcode: 2535

If you have not registered your email ID with the Company/DP, you may please follow the below instruction for obtaining login details for e-voting:

Physical Holding	Please send a request to RTA Big Share Services Pvt Ltd A/802, Samudra Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road Navrangpura, Ahmedabad- 380009 Tel No. 079-40024135 email bssahd3@bigshareonline.com, provided you name, folio no. scanned copy of share certificate(front and back) self attested/scanned copy of PAN and AADHAR Card for registering email ID
Demat Holding	Please contact your DP and register your email address in your demat account as per the process advised by your DP

Notice is also hereby given that, pursuant to Section 91 and other applicable provisions, if any of the Companies Act, 2013 and as per SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, that the **Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday 23rd September, 2020 to Wednesday 30th September, 2020 (both days inclusive)** for the purpose of 28th Annual General Meeting (AGM). The Member who have cast their vote through remote e-voting prior to the AGM may also participate the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting facilities available during the AGM.

Once the Member cast vote on a resolution, the Members shall not be allowed to change it subsequently detailed instructions for remote e-voting joining the AGM and e-voting during the AGM is provided in the Notice of 28th AGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rules framed thereunder and as per SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide remote e-voting facility to its members to exercise their rights to vote electronically on all resolutions set forth in the Notice convening the 28th Annual General Meeting. The Notice is displayed on the Website of the Company www.unickfix-a-form.com and also on the website of BSE at <https://www.bseindia.com/stock-share-price/unick-fix-a-form-and-printers-ltd/unick/541503/>. The company has engaged in the services of Central Depository Services (India) Limited (CDSL) to provide e-voting facility to its members. The company has appointed M/s. Vishakha Agrawal & Associates, Practicing Company Secretaries, Indore to act as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

The remote e-voting facility will be available during the following voting period:-
The date and time of Commencement of E-Voting—Sunday, 27th September, 2020 at 9:00 A.M.
The date and time of End of E-Voting—Tuesday, 29th September, 2020 at 5:00 P.M.
During this period, members of the company, holding shares either in physical form or in dematerialized form as on the cutoff date (**22nd September, 2020**) may cast their vote electronically.

The result of the voting will be declared within 48 hours from the conclusion of AGM i.e. on or before 01st October, 2020 and results so declared along with the Scrutinizer Report will be placed on the website of the company and BSE website.

In case of you have any of queries or issues regarding e-voting write an email to helpdesk.evoting@cdsl.com call on Toll free no. 1800 22 5533 or contact our RTA Big Share Services Pvt Ltd A/802, Samudra Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road Navrangpura, Ahmedabad- 380009 Tel No. 079-40024135 email bssahd3@bigshareonline.com

BY ORDER OF THE BOARD
FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD
Sd/- **Bhupen Navnit Vasa**
Managing Director
DIN: 00150585

Place : Ahmedabad
Date : 19.08.2020

BOARD MEETING
KUSH INDUSTRIES LIMITED
This is to inform you that the Board of Directors of the Company will meet on 27th August, 2020 for taking on record the Unaudited Financial Results for the quarter ended on 30th June, 2020.

જાહેરાત

કૃમિ બાયો ટેક પ્રા. લિમિટેડ કંપનીના નીચે ઉલ્લેખ કરેલ પાણીમાં સંપૂર્ણપણે વિદ્યાર્થિ મિશ્ર ખાતરના એન.પી.કે.૧૯-૧૯-૧૯ (100% WATER SOLUBLE MIXTURE OF FERTILIZER) આયાત કરીને ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં વેચાણ કરવાના છીએ. ઉપરના ઉત્પાદનોની ગુણવત્તા THE FERTILIZER (CONTROL) ORDER 1985 મુજબ NOTIFICATION No. S.O: 4120 (E) Dt. 31/12/2017 મુજબ રહેશે.

કૃમિ બાયો ટેક પ્રા. લિમિટેડ

ફેક્ટરી: સર્વે નં. 2078, મોજે ઘલોલ, તા. હિંમતનગર, જિલ્લો: સાબરકાંઠા.
ઓફિસ : 301, શક્તિ એસ્ટેટ, ગ્રામસહ હોસ્પિટલની બાજુમાં, દેલપુર રોડ, ચલવેત, અમદાવાદ - 380054, ફોન: 7574857202

CEEJAY FINANCE LIMITED
CIN: L65910GJ1993PLCO19090, Regd. Office: C.J. House, Mota Pore, Nadiad-387001, Gujarat. Tele Fax:0268-2561727,
E-Mail: shaileshbharvad@ceejaygroup.com, Website: www.ceejayfinance.com

NOTICE TO THE MEMBERS FOR 27TH ANNUAL GENERAL MEETING

1. NOTICE is hereby given that the 27th Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") on Saturday, 26th September, 2020 at 11.00 a.m. (IST), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder as well as Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("LODR") read with General Circular No. 14/2020 dated 08th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No.20/2020 dated 05th May, 2020 and other applicable Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI ("relevant Circulars") without the physical presence of the members at a common venue to transact the Business set out in the Notice calling AGM. Members will be able to attend the AGM through VC/OAVM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under section 103 of the Companies Act, 2013.

2. In compliance with the relevant circulars, the Notice of the AGM and the standalone financial statements for the financial year 2019-20, along with the Board's Report, Auditor's Report and other documents required to be attached thereto, will be sent to all the members of the Company whose email address are registered with the Company/Depository Participant(s) the aforesaid documents will also be available on the company's website and on the website of the Stock Exchange, i.e. BSE Limited at www.bseindia.com.

3. Manner of casting vote(s) through e-voting:
(a) Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of AGM through electronic voting system ("e-voting").
(b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialised mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the company and website of the CDSL at www.evotingindia.com.
(c) The facility for voting through electronic voting system will also be made available at the AGM and members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.

4. Manner of Registering/updating email addresses:
(a) Members holding shares in Physical Mode, who have not registered/updated their email addresses with the company, are requested to visit the website of the company's Registrar at https://linkintime.co.in/EmailReg/Email_Register.html and upload required documents therein.
(b) Members holding shares in dematerialised mode, who have not registered/updated their email addresses, are requested to register/update their email addresses with depository participants with whom they maintain their demat accounts.
(c) Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and in particular, instruction for joining the AGM, manner of casting vote through remote e-voting or through e-voting during the AGM.

For, Ceejay Finance Limited
Sd/-
Shailesh Bharvad
Company Secretary

Place: Nadiad
Date : 19th August, 2020

GUJARAT WATER SUPPLY & SEWERAGE BOARD

E-TENDER NOTICE No. 04 / 2020-21
TENDER I.D. NO. (1) 420032 (2) 420036 (3) 420324

Tender are invited through E-Tendering bid system by the Executive Engineer, Public Health Works Dn., Khambhalia Devbhoomi Dwarka (Phone No. 02833-235765 / 235766 M.No. 9978406618) from the Government registered Contractors in proper class and above and having the financial and technical criteria laid down in tender documents for post qualification purpose for the work of below :

Sr. No.	Name of work	Rs. in Lakhs
1	(Tender ID No. 420032) Comprehense O & M for NC-21 Bulk pipe line from Panchdevada H/W to Ghee Dam H/W Tal. Khambhalia Dist. Devbhumi Dwarka. 24 Months.	Rs.21.90 Lakhs
2	(Tender ID No. 420036) Comprehense O & M for Bhavad Group RWSS 2020-21 Tal. Bhawanad Dist. Devbhumi Dwarka. Based on Narmada pipe line NC-21. 24 Months.	Rs.52.18 Lakhs
3	(Tender ID No. 420324) Comprehense O & M for Khambhalia Group RWSS 2020-21 Tal. Khambhalia / Kalyanpur Dist. Devbhumi Dwarka. Based on Ghee Dam and NC-21 pipe line. (Second attempt) 24 Months	Rs.73.96 Lakhs

Tender documents can be seen down-loaded and submitted on website www.nprocure.com. Detailed information of the tender are available on website as mentioned above last date of submission of Tender ID (1) **420032 (2) 420036 (3) 420324 dt 28.08.2020 up to 18.00 hrs.** (No offer in physical form will be accepted and any such offer if received by GWSSB will be out right rejected. Contact the toll free helpline number 1916 for the complain of rural water supply.

Mahiti/Jam/28/2020-21

